KJ-BK-3-17

સં ૨૦૦૨ ના આસો સુદ ૫ રવિવાર ના રોજ [illegible] શ્રી નખત્રાણા [illegible]
[illegible] શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન [illegible]
[illegible] નખત્રાણા [illegible]
[illegible]
[illegible]
[illegible]

૧ શ્રી પ્રભુની પ્રાર્થના

૨ પ્રમુખની દરખાસ્ત રજુ કરનાર પટેલ [illegible]
[illegible]
[illegible]
[illegible]
પ્રમુખનું [illegible]
તે બાદ પટેલ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

૧ ઠરાવ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] શ્રી કચ્છ કડવા પાટીદાર [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

Real Patidar Library

About Real Patidar books

૧૭

KJ-BK-3-17

સં. ૨૦૦૨ના આષાઢ વદિ ૫ રવિવારના રોજ શાળામાં શ્રી નખત્રાણા મુકામે પૂર્વ
[illegible] કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના
કાર્યવાહક કમિટીની [illegible] નખત્રાણા [illegible]
[illegible]
[illegible]
[illegible]

૧ શ્રી પ્રભુની પ્રાર્થના

૨ પ્રમુખની દરખાસ્ત [illegible] પટેલ નાનજી [illegible]
[illegible] પટેલ રતનશી [illegible]
મહારાજ [illegible]
ટેકો આપનાર પટેલ [illegible] નખત્રાણા [illegible]
પ્રમુખનું વાંચન
તે બાદ પટેલ નાનજી [illegible] નું વાંચન
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

૧ ઠરાવ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] ધર્મ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

૧૯

KJ-BK-3-18

વાગ્ભર સ્થાપનાને અમુક રકમ ઉઘરાવવા [illegible] ભાઈઓ
સાથે એક કમીટી નીમવામાં આવી હતી અને તે કમીટીની
ઉપર નાખવામાં ~~[illegible]~~ નક્કી કરવા માટે [illegible]
ઈચ્છાનો જણાવ્યું તેમાં [illegible] જણાવ્યું કાંપુરા
છતાં સ્થાપવામાં આવી

કમીટીના ભાઈઓના નામ

૧ ભાઈ રતનશી ખીમજી વાકાણી.
૨. આણંદજી ભાઈ કરશન કેરા
૩ વાલજીભાઈ પરસોત્તમ. કેરા
૪ રામજીભાઈ લાલજી ગઢશીસા
૫ શામજીભાઈ રામજી કેરા કુંદનપર
૬ દેવજીભાઈ [illegible] [illegible] [illegible]
૭ રામજીભાઈ કરશન. નખત્રાણા
૮ લાલજીભાઈ કરશન. દેશલપર - ગ [illegible]
૯ જીવરાજભાઈ [illegible]. માનકુવા

ઉપર પ્રમાણે કમીટી નીમવામાં આવી હતી. જે તેના સંચાલક [illegible] ખરચ નો વહીવટ ચલાવવા સત્તા સોંપવામાં આવી હતી.

૨. ઠરાવ

કેળવણી સંબંધના

આપણી જ્ઞાતિના બાળકોને સંપૂર્ણ રીતે કેળવણી આપવી. અને તે કેળવણી આપવા માટે ફંડની એક યોજના તૈયાર કરવી. અને તે યોજના અમલમાં લાવવા માટે જ્ઞાતિમાંથી વાર્ષિક ફાળો ઉઘરાવવા અને તેનો વહીવટ ચલાવવા માટે એક [illegible] કમીટી નીમવી.

૩ ઠરાવ

આપણી જ્ઞાતિના [illegible] [illegible] છે તે આપણા આગેવાનો [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] અને તેના [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]

KJ-BK-3-19

[illegible]

૨૦ KJ-BK-3-20

લાઈબ્રેરીમાં આપેલાં હતાં જે તે બાદ એમને નહીં ફેરવવાનાં આવ્યું હ
તું. આ લાયબ્રેરીના [illegible] ના બદલે [illegible] ગામોમાં
જુદા જુદા આગેવાનોને [illegible] ને [illegible]
વહેંચી [illegible] [illegible] આગેવાન [illegible]
[illegible] આગેવાનોને [illegible] ફેરવવામાં આવ્યા હતા. ત
બાદ [illegible] ~~[illegible]~~ [illegible] ફેરવવામાં આવ્યા
હતા.

અનુક્રમણે [illegible]

[illegible] સનાતન [illegible] ના પ્રેસીડેન્ટ
[illegible]

[illegible]
[illegible]